

ઓક્ટોબર 16, 2018

## મનોરંજનલક્ષી ગાંજના કાનૂનીકરણની તૈયારી કરવામાં બ્રામ્પટન સુરક્ષાને અગ્રતા આપવાની ઝાંખી કરાવે છે

બ્રામ્પટન, ઓન્ટેરિયો – ઓક્ટોબર 17, 2018 નાં રોજ મનોરંજનલક્ષી ગાંજનું (રિક્રિએશનલ કેનેબિસનું) કાનૂનીકરણ કરતા પહેલાં, સીટી ઓફ બ્રામ્પટન રહેવાસીઓને ગાંજો ધરાવવો કે તેનો મનોરંજનલક્ષી ઉપયોગ કરતી વખતે સુરક્ષાને પહેલી અગ્રતા આપવા કહે છે.

બ્રામ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના આંકડાઓ દર્શાવે છે કે ગત પાંચ વર્ષોમાં ઘરોમાં લાગેલી 31 ટકા જેટલી જીવલેણ આગની ઘટનાઓ થવા પાછળનું કારણ ધૂમ્રપાન સામગ્રી અયોગ્ય રીતે ફેંકવાનું/નાખવાનું હતું. ગાંજના ધૂમ્રપાનનું નિયમન તમાકુની જેમ કરવામાં આવશે, અને ગાંજો વપરાશકારોએ પોતાની જાત, પોતાના કુટુંબીજનો, સગીરો, પાળેલા પ્રાણીઓ, અને મિલકતનું સંરક્ષણ કરવા સુરક્ષિત ઉપયોગ માટે જવાબદાર બનવાની જરૂર પડશે.

### અગ્નિ સુરક્ષા

ગાંજો વપરાશકારોને ગાંજનું સેવન કર્યા પછી રસોઈ ન બનાવવાની સલાહ આપવામાં આવે છે. રહેવાસીઓને ઘરબાર દીઠ ગાંજના ચાર છોડ વાવવાની કાયદેસર સીમા ન વટાવવાનું, અને પોતાની ઈલેક્ટ્રિકલ સિસ્ટમમાં કોઈ સુધારો ન કરવા અથવા ઉચ્ચ લીટ લેમ્પ્સથી આગનું ગંભીર જોખમ થતું હોવાથી તે ન વાપરવાનું પણ યાદ અપાવવામાં આવે છે.

### ગાંજની ક્યાં મનાઈ છે

ગાંજના ધૂમ્રપાનની મનાઈ, તમાકુના ધૂમ્રપાનની મનાઈ હોય તેવા તમામ સ્થળોએ લાગુ પડે છે, દા.ત. બંધ જાહેર સ્થળો/કાર્યસ્થળો, બાળકોનું રમત મેદાન અને બગીચાઓમાં રમવાની જગ્યાઓ, જાહેર રમતગમતની જગ્યાઓ (દા.ત. સ્પેશ પેડ્સ, સોકર ફિલ્ડ્સ) અને બધાં બાર અને રેસ્ટોરન્ટની ઉઘાડી જગ્યાના 20 મીટરની અંદર. મનાઈ કરેલી જગ્યાઓની પૂરી યાદી માટે, સીટીની વેબસાઈટ પર [FAQ વિભાગ](#) જુઓ.

### કોનો સંપર્ક કરવો

સીટી ઓફ બ્રામ્પટનની સાથે સાથે રીજીયન ઓફ પીલ આ શહેરની મિલકતો જેમ કે મ્યુનિસિપલ ઈમારતો, મનોરંજન કેન્દ્રો, ટ્રાન્ઝિટ શેલ્ટર્સ (આઉટડોર આશ્રયસ્થાનો), અને બગીચાઓ સહિતની બાળકોને રમવાની જગ્યાઓની નજીકમાં ધૂમ્રપાન કરવાને લગતી ફરિયાદોને ધ્યાનમાં લેશે. રહેવાસીઓ આ ચિંતાઓની જાણ 311 નંબર પર ફોન કરીને અથવા [311@brampton.ca](mailto:311@brampton.ca) સરનામે ઈમેલ મોકલીને કરી શકે છે. કટોકટી સમયે માત્ર 911 નંબર પર ફોન કરો.

ગાંજના સેવન હેઠળ ડ્રાઈવિંગ, સગીર વપરાશકારોને ગાંજનું વેચાણ અને ગાંજનો ગેરકાયદેસર કબજો ધરાવવાને સંબંધિત ઘટનાઓ માટે, પીલ રીજીયન પોલીસનો સંપર્ક કરો:

- કટોકટી સમયે: 911
- કટોકટી-સિવાયના સમયે: 905.453.3311
- પીલ ક્રાઈમ સ્ટોપર્સ (ગુનો અટકાવવામાં મદદ): 1.800.222.8477

ગાંજને લગતી આરોગ્ય-સંબંધિત માહિતી માટે, પીલ પબ્લિક હેલ્થનો સંપર્ક 905.799.7700 નંબર પર કરો અથવા કેનેડા સરકારનું ઔપચારિક સંસાધન [કેનેડામાં ગાંજો](#) જુઓ.

### ગાંજો વેચતા રિટેલ સ્ટોર્સ

નવું સીટી કાઉન્સિલ (ડિસેમ્બર 1, 2018 થી અમલી) નક્કી કરશે કે શું બ્રામ્પટનમાં ગાંજના રિટેલ સ્ટોર્સની છૂટ આપવી જોઈએ કે નહીં. ઓન્ટેરિયો પ્રાંતમાં આ નિર્ણય જાન્યુઆરી 22, 2019 સુધીમાં કરવાનો રહે છે. સીટી સ્ટાફ ગાંજના રિટેલ સ્ટોર્સને લગતા “માહિતી માટે” અહેવાલ પર કામ કરી રહ્યા છે, જે નવી કાઉન્સિલને ડિસેમ્બર 5, 2018 નાં રોજ રજૂ કરવામાં આવશે, જેથી તેઓને માહિતગાર નિર્ણય લેવામાં મદદ મળે.

ઓક્ટોબરના અંતે, આ શહેર ગાંજના રિટેલ સ્ટોર્સ બ્રામ્પટનમાં રાખશે/નહિ રાખે તે અંગે રહેવાસીઓનું મંતવ્ય જાણવા જાહેર મતદાન (પબ્લિક પોલ) કરાવશે. મતદાનના પરિણામો અહેવાલના ભાગ તરીકે કાઉન્સિલને પૂરા પાડવામાં આવશે જેથી તેઓ રિટેલ સ્ટોર્સ રાખવા/નહિ રાખવાને સંબંધિત નિર્ણયના ભાગ તરીકે વિચારી શકે.

### ગાંજના સેવન હેઠળ ડ્રાઈવિંગ

પીલ રીજીયન પોલીસ અને અધિકારીઓ માટે રસ્તા પર સુરક્ષાનું બહુ મહત્વ છે અને તેથી તેઓને નશીલી દવાઓનું સેવન કરેલા ડ્રાઈવરોને શોધી કાઢવાની તાલીમ આપવામાં આવી છે. નશીલી દવાઓના સેવન હેઠળ ડ્રાઈવિંગ કરનારાઓ પર આલ્કોહોલના સેવન હેઠળ ડ્રાઈવિંગ કરવા પર ભોગવવા પડતા પરિણામો જેવા સરખા પરિણામોનો આરોપ મૂકવામાં આવશે, જેમાં સામેલ હોઈ શકે છે: તાત્કાલિક લાઈસન્સ રદ કરવું, નાણાકીય દંડ, વાહન કબજે કરવું, ગુનાહિત રેકોર્ડ ઊભો થવો અને જેલમાં કેદ.

જીવાન, નવા ડ્રાઈવરો અને કોમર્શિયલ ડ્રાઈવરો માટે શૂન્ય સહિષ્ણુતા લાગુ થશે. જો તમે કોમર્શિયલ ડ્રાઈવર, 22 વર્ષ નીચેની ઉંમરના ડ્રાઈવર અથવા G1, G2, M1, કે M2 લાઈસન્સ ધરાવતા હો તો, તમારા કબજામાં પ્રિસ્ક્રાઈબ કર્યા સિવાયના ગાંજની કોઈ માત્રા ધરાવવી ગેરકાયદેસર બને છે.

### ગાંજનો કબજો ધરાવવો

ગાંજનો કબજો રાખવાની સીમા મહત્તમ 30 ગ્રામ (આશરે એક ઑંસ) છે જે સૂકા ગાંજ તરીકે જાહેરમાં રાખી શકાય છે. રહેઠાણ દીઠ (વ્યક્તિ દીઠ નહીં) મહત્તમ ચાર છોડ રાખી શકાય છે. વધુ માહિતી પીલ રીજીયનલ પોલીસના [ગાંજો અને કાયદો સંબંધિત વેબપેજ](#) પર જોઈ શકાય છે.

### અવતરણો (ક્વોટ્સ):

“સામુદાયિક સુરક્ષા અમારી અગ્રતા છે. આમાં ગાંજનો ઉપયોગ, તૈયારી અને છોડ ઉછેર સંબંધિત અગ્નિ સુરક્ષા ચિંતાઓ પ્રોત્સાહિત કરવી, તેમજ જાહેર જગ્યાઓએ ગાંજના વપરાશનું અમલીકરણ સામેલ છે. આ શહેર સામુદાયિક સુરક્ષા ટોચમાં રહે તેની ખાતરી કરવા આપણાં ભાગીદારો અને પ્રાંતીય અને સંઘીય સરકારો સાથે કામ કરવાનું પણ ચાલુ રાખશે.”

- મેયર લિન્ડા જેફ્રી (Linda Jeffrey)

“મનોરંજનલક્ષી ગાંજો કાયદેસર બને એટલે, આપણે એ ખાતરી કરાવવામાં સાથે મળીને કામ કરવાનું રહે છે કે આપણું પડોશ દરેક વ્યક્તિ માટે સુરક્ષિત અને આનંદપ્રદ બની રહે. ગાંજનો ઉપયોગ જાહેર જગ્યાઓએ કે તમારા ઘરમાં એમ ગમે ત્યાં કરો ત્યારે, અમે કહીએ છીએ કે રહેવાસીઓ પોતાની અને બધી રીતે સમુદાયની સુરક્ષા અંગે જાગૃત રહે.”

- પ્રાદેશિક કાઉન્સિલર અને ચેરમેન, સામુદાયિક સેવાઓ, માર્કલ પાલેશી (Michael Palleschi)

“સ્વતંત્રતા જવાબદારીને સાથે લાવે છે. અમે અહીં બ્રામ્પટનમાં જીવલેણ આગની દુ:ખદ ઘટનાઓ અનુભવી છે, અને દરેક વ્યક્તિ કોઈપણ પ્રકારની ધૂમ્રપાન સામગ્રીના સુરક્ષિત ઉપયોગ માટે જવાબદાર બને તેવી આપણને જરૂર છે. જીવન તેની પર નિર્ભર બની શકે છે.”

- ફાયર ચીફ બિલ બોયસ (Bill Boyes), બ્રામ્પટન ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ

“અમે જાણીએ છીએ કે નવો ગાંજો ધારો એક વખત અમલી બને એટલે અનુકૂલનશીલ થવામાં સમય લાગશે. સામુદાયિક સુરક્ષા અમારી ટોચની અગ્રતા બની રહે છે અને અમે અમારા સામુદાયિક ભાગીદારો સાથે ધનિષ્ઠપણે કામ કરવાનું ચાલુ રાખીશું જેથી જાહેર જનતાને જરૂરી માહિતી પૂરી પાડીને તેઓની સુરક્ષા અને સુખાકારીની ખાતરી કરી શકાય.”

- સુપ્રિન્ટેન્ડેન્ટ મેન્યુઅલ રોડ્રિગ્સ (Manuel Rodrigues), પીલ રીજીયનલ પોલીસ

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મિડિયા સંકલનકર્તા

સીટી ઓફ બ્રમ્પટન

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)

સાર્જન્ટ મેટ બર્ટ્રામ (Matt Bertram)

પબ્લિક ઈન્ફર્મેશન એન્ડ મીડિયા રિલેશન્સ

પીલ રીજીયનલ પોલીસ

905-453-2121 એક્સ્ટેન્શન 4030